

# સંદર્ભ બુદ્ધિગ્રાહ્યતા માપક : ગુજરાતી

## Intelligibility in Context Scale (ICS): Gujarati

(McLeod, Harrison, & McCormack, 2012)

Translated by: Urvi Dave, NAATI accredited translator for Australian Multi Lingual Services, Australia, 2013

બાળકનું નામ (Child's name): \_\_\_\_\_

બાળકની જન્મ તારીખ (Child's date of birth): \_\_\_\_\_ બાળકની જાતિ (Male/Female): \_\_\_\_\_

ભાષાઓ (Language(s) spoken): \_\_\_\_\_

આજની તારીખ (Current date): \_\_\_\_\_ બાળકની ઉંમર (Child's age): \_\_\_\_\_

ફારમ ભરનાર વ્યક્તિનું નામ (Person completing this form): \_\_\_\_\_

બાળક સાથેનો સંબંધ (Relationship to child): \_\_\_\_\_

નીચેના પ્રશ્નો તમારા બાળકની બોલીને જુદાં જુદાં લોકો કેટલું સમજી શકે છે તે બાબતમાં છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે પાછલાં એક મહિનાનો વિચાર કરશો. દરેક પ્રશ્ન માટે એક આંકડાંની ફરતે ગોળ દોરશો.

(The following questions are about how much of your child's speech is understood by different people. Please think about your child's speech over the past month when answering each question. Circle one number for each question.)

	હંમેશાં (Always)	મોટાભાગે (Usually)	ક્યારેક (Sometimes)	ભાગ્યેજ (Rarely)	ક્યારેય નહિં (Never)
1. તમે તમારા બાળકને સમજો છો ? (Do you understand your child <sup>1</sup> ?)	5	4	3	2	1
2. તમારા તરતનાં સગાં તમારા બાળકને સમજે છે ? (Do immediate members of your family understand your child?)	5	4	3	2	1
3. તમારાં દૂરનાં સગાં તમારા બાળકને સમજે છે ? (Do extended members of your family understand your child?)	5	4	3	2	1
4. તમારા બાળકનાં મિત્રો તમારા બાળકને સમજે છે ? (Do your child's friends understand your child?)	5	4	3	2	1
5. બીજાં ઓળખીતાંઓ તમારા બાળકને સમજે છે ? (Do other acquaintances understand your child?)	5	4	3	2	1
6. તમારા બાળકનાં શિક્ષકો તમારા બાળકને સમજે છે ? (Do your child's teachers understand your child?)	5	4	3	2	1
7. અજાણ્યાં લોકો તમારા બાળકને સમજે છે ? (Do strangers <sup>2</sup> understand your child?)	5	4	3	2	1
કુલ સંખ્યા (TOTAL SCORE) =	/35				
સરેરાશ કુલ સંખ્યા (AVERAGE TOTAL SCORE) =	/5				

<sup>1</sup> આ માપણીમાં બાળકને બદલે જીવનસાથી મૂકી તેને પુખ્તવયનાં વ્યક્તિની બોલવાની ક્ષમતાં માપવા માટે ઉપયોગમાં લઈ શકાય.

(This measure may be able to be adapted for adults' speech, by substituting *child* with *spouse*.)

<sup>2</sup> અજાણ્યાં લોકોને બદલે ઓળખીતાં ન હોય તેવાં લોકો એવો શબ્દપ્રયોગ પણ કરી શકાય છે. (The term *strangers* may be changed to *unfamiliar people*.)

સંદર્ભ બુદ્ધિગ્રાહ્યતા માપકની આ આવૃત્તિની નકલ કરી શકાય છે. (This version of the Intelligibility in Context Scale can be copied.)

Intelligibility in Context Scale is licensed under a [Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License](https://creativecommons.org/licenses/by-nc-nd/3.0/).

McLeod, S., Harrison, L. J., & McCormack, J. (2012). The Intelligibility in Context Scale: Validity and reliability of a subjective rating measure. *Journal of Speech, Language, and Hearing Research*, 55(2), 648-656. <http://jslhr.asha.org/cgi/content/abstract/55/2/648>

